

થોર્નક્લિફ પાર્કમાં નવું ઇસ્લામિક સેન્ટર

ઓન્ટારિયો લાઇન (Ontario Line) પ્રોજેક્ટના ભાગરૂપે, ઇસ્લામિક સોસાયટી ઓફ ટોરોન્ટો (IST) અને Metrolinx 20 Overlea Boulevard ખાતેની હાલની ઇમારતને થોર્નક્લિફ પાર્ક સમુદાયમાં નવા ઇસ્લામિક સેન્ટરમાં રૂપાંતરિત કરવા ભાગીદારીમાં કામ કરી રહ્યા છે.

નવા કેન્દ્રમાં હશે:

- વિકસતા સમુદાયને સમર્થન આપવા માટે 4 થોર્નક્લિફ પાર્ક ડ્રાઇવ ખાતે ISTની વર્તમાન સુવિધા કરતાં પાંચ ગણી વધુ જગ્યા;
- નવી સુવિધાઓની શ્રેણી જે યુવા પ્રવૃત્તિઓ માટે જગ્યા પૂરી પાડશે, એક નવું જીમ્નેશિયમ અને શૈક્ષણિક કાર્યક્રમો;
- સ્ત્રીઓ માટે વધુ સારી અને સુધારેલી પ્રાર્થના માટેની જગ્યાઓ;
- જેમની મિલકતો ઓન્ટારિયો લાઇન(Ontario Line) યોજનાઓથી પ્રભાવિત છે તેમના માટે 19 જેટલા સ્થાનિક વ્યવસાયો અને સમુદાયના સંગઠનો માટે હબ તરીકે સેવા આપવા માટે 24,000 ચોરસ ફૂટ સુધીની વધારાની જગ્યા;
- સુવિધાઓ કે જે, પ્રથમ વખત, મસ્જિદને થોર્નક્લિફ પાર્ક સમુદાયમાં ઇસ્લામિક અંતિમ સંસ્કાર સેવા પ્રદાન કરવા સક્ષમ બનાવશે.

આ નવું કેન્દ્ર ઇસ્લામિક સોસાયટી ઓફ ટોરોન્ટો(IST)ની નવી, વિસ્તૃત સુવિધા માટેના વિઝનને સાકાર કરે છે જે થોર્નક્લિફ પાર્ક અને ફ્લેમિંગ્સન પાર્કમાં સમુદાયોને સેવા આપી શકે છે, જે ઓન્ટારિયો લાઇન(Ontario Line) સબવે પરના ભાવિ થોર્નક્લિફ સ્ટેશનથી માત્ર થોડા જ પગલાં દૂર છે.

ઓન્ટારિયો લાઇન(Ontario Line) વિશે ઝડપી હકીકતો

- ઓન્ટારિયો લાઇન(Ontario Line) એ 15.6-કિલોમીટરની, 15-સ્ટોપ સબવે લાઇન છે જે એક્ઝિબિશન પ્લેસ(Exhibition Place)થી, ડાઉનટાઉનના હાર્ટમાંથી અને ઓન્ટારિયો સાયન્સ સેન્ટર(Ontario Science Centre) સુધીના તમામ માર્ગો સુધી ચાલશે, જેમાં થોર્નક્લિફ પાર્ક અને ફ્લેમિંગ્સન પાર્કના સ્ટોપ્સનો સમાવેશ થાય છે.
- ઓન્ટારિયો લાઇન(Ontario Line) માટે [જાળવણી અને સંગ્રહની સુવિધા](#), જ્યાં ટ્રેનોને અમારા ગ્રાહકો માટે સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે રાખવામાં આવશે અને જાળવણી કરવામાં આવશે, તે થોર્નક્લિફ પાર્કમાં સ્થિત હશે વિસ્તાર જ્યાં IST ની વર્તમાન સુવિધા સ્થિત છે. એકવાર ઓન્ટારિયો લાઇન(Ontario Line) કાર્યરત થઈ જાય તે પછી તે સમુદાય માટે 300 થી વધુ નવી નોકરીઓ લાવશે.
- ઓન્ટારિયો લાઇન(Ontario Line) થોર્નક્લિફ પાર્ક અને ડાઉનટાઉન ટોરોન્ટો વચ્ચેની મુસાફરીના સમયમાં 15 મિનિટ જેટલો ઘટાડો કરશે. તે પ્રાદેશિક ગો(GO) ટ્રેનો, હાલના સબવે, એગ્લિન્ટન ક્રોસટાઉન(Eglinton Crosstown) LRT અને સ્થાનિક બસ અને સ્ટ્રીટકાર લાઇનો સહિત 40 થી વધુ અન્ય મુસાફરી વિકલ્પો સાથે જોડાઈને સમગ્ર શહેરમાં હાલની ટ્રાન્ઝિટ લાઇનો પર ભીડથી લોકોને રાહત આપશે.
- 2041 સુધીમાં, થોર્નક્લિફ સ્ટેશન કરશે:
 - 12,800 લોકોને ચાલવાના અંતરની અંદર પરિવહનમાં લાવો;
 - મુસાફરીના સૌથી વ્યસ્ત કલાકો દરમિયાન અંદાજે 3,100 ગ્રાહકોને સ્ટેશન પરથી પસાર થતા જુઓ (2,100 ઓન્ટારિયો લાઇન(Ontario Line) પરથી ચડી રહ્યા છે અને 1,100 ઓન્ટેરિયો લાઇન(Ontario

Line) પરથી ઉતરી રહ્યા છે), તેમાંથી 500 અન્ય ટ્રાન્ઝિટમાં અથવા ત્યાંથી ટ્રાન્સફર લઈ રહ્યા છે;

- વિસ્તારમાં 3,000 નોકરીઓ સાથે જોડાઓ.